

December 08, 2021

10,	
BSE Limited,	National Stock Exchange of India Ltd,
Dept. of Corporate Services,	Listing Department
Phiroze Jeejeebhoy Towers,	Exchange Plaza, Bandra Kurla Complex,
Dalal Street,	Bandra (East), Mumbai – 400051
Mumbai - 400 001	Scrip Symbol: SETCO
Company Code: 505075	

Dear Sirs,

Sub: Intimation under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to Regulation 30 of Listing Regulations, please find enclosed copies of notices given to shareholders in accordance with Regulation 47 of the Listing Regulations and applicable provisions of Companies Act, 2013 read with Rules made thereunder, informing them about 38th Annual General Meeting of the Company, Remote e-voting instructions and Book Closure related details. The notice was published in the following newspapers on December 8, 2021:

- i. Financial Express (English)
- ii. Financial Express (Gujarati)

This is for your information and record.

Thanking you,

Yours faithfully, **For Setco Automotive Limited**

Hiren Vala Company Secretary

Encl: As above

FINANCIAL EXPRESS

17

RILIEF ROAD BRANCH इंडियन बैंक 🤼 Indian Bank 575/1, Padshah's Pole, Relief Road, Ahmedabad-01 ▲ इलाहाबाद ALLAHABAD Ph.: 079-25356883

[Under Rule (8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Possession Notice (for Immoveable property)

Whereas, The undersigned being the Authorised officer of the Indian Bank (erstwhile Allahabad Bank) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) (read with Rule 3, 8, 9) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09.08.2021 calling upon the borrower M/s MARUTI ENTERPRISE (Proprietorship firm) Borrower: Mr. Anil D Shivalaker (Borrower / Mortgage and Proprietor M/s Maruti Enterprise), and Mr. Prabhat Singh Chavda (Guarantor) and Mr. Sunil Dattaraya (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 24,02,884.16 (Rupees Twenty Four Laks two Thousands Eight Hundred Eighty Four and Sixteen Paisa only only) as on 09.08.2021 and future interest & Expenses thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the borrowers/guarantors/mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with Rule 3, 8, 9 of the said Rules on 3rd day of December of the year Two Thousand Twenty One.

The borrowers/Guarantors/Mortgagor in particular and the public in general are hereby cautioned not to deal with this property and any dealings with the property will be subject to the charge of Indian Bank (erstwhile Allahabad Bank), Relief Road Branch for an Rs. 24,02,884.16 (Rupees Twenty Four Laks two Thousands Eight Hundred Eighty Four And Sixteen Paisa only only) as on 09.08.2021 and future interest & expenses thereon.

The borrowers attention is invited to the provision of subsection 8 of Section 13 of the Act in respect of time available, to redeem the secured assets.

Description of Immovable Property

All that piece and parcel of the Residential immovable property situated at Teanament No. 16, admeasuring construction area of about 219.20 sq mtrs approximately in a scheme known as New Arvindnagar Co Op. Housing Society Ltd. Vibhag 2 on NA land bearing Survey no 97/1 paiki, TP Scheme No 12 of FP No 171 Paiki sub plot no 4/B, Admeasuring about 1680 sq yards lying at mouje Rakhiyal Taluka Ahmedabad city (East) in Registration district of Ahmedabad and Registration sub district of Ahmedabad-7 (Odhav) With the state of Gujarat in the name of Mr. Anil Dattatarya Shivalekar. The boundaries of the property are : North : Tenament No. 17, South : Tenament No. 15, East : Society Road, West : Tenament No. 36 Chief Manager & Authorised Officer Date : 03.12.2021 Place : Ahmedabad

For Indian Bank

Naranpura Branch, इंडियन बैंक 🥼 Indian Bank Vijaynagar char Rasta, Ahmedabad, Gujarat-380013 ALLAHABAD Phone : 079-27470681, Fax : 079-27437868

APPENDIX IV [Rule 8(1)] POSSESSION NOTICE (For immovable property)

▲ इलाहाबाद

Whereas. The undersigned being the authorized officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) rules, 2002 issued a demand notice dated 08.04.2021 calling upon the borrowers and Guarantors M/s. Poonam Industries works (Proprietorship firm & Borrower) and Mr. Bharat Parsottamdas Panchal (Proprietor of M/s Poonam Industries Works & Mortgagor) and Mr Dhirajbhai Khemchandbhai Panchal (Gurantor) are having account Term Loan & OCC Limit with our Naranpura Branch to repay the amount mentioned in the notice being Rs. 39,71,613.76 (Rs. Thirty Nine Lakhs Seventy One Thousand Six Hundred Thirteen and paise Seventy Six Only) [Term Loan O/s Bal Rs. 14,65,335.98 + MOI Bal. Rs. 2,01,162.18 Total Rs. 16,66,498.16 & OCC Limit O/s Bal 20,71,156.49 + MOI Bal. Rs. 2,33,959.12 Total Rs. 23,05,115.60 Grand Total Rs. 39,71,613.76] @ 8.30%] and interest thereon from 03.12.2021 till date of repayment within 60 days from the date of said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 & 9 of the said rule on this 04th day of December of the year 2021.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount Rs. 39,71,613.76 (Rs. Thirty Nine Lakhs Seventy One Thousand Six Hundred Thirteen and paise Seventy Six Only) [Term Loan O/s Bal Rs. 14,65,335.98 + MOI Bal. Rs. 2,01,162.18 Total Rs. 16,66,498.16 & OCC Limit O/s Bal 20.71.156.49 + MOI Bal. Rs. 2.33.959.12 Total Rs. 23,05,115.60 Grand Total Rs. 39,71,613.76] @ 8.30%] as on 03.12.2021 (please mention the date upto the previous month) with further interest, costs, other charges and expenses thereon.

Description of Immovable Property

Property : Flat No. 7/B having area admeasuring 67.95 sq mtrs. In the scheme known as Radhe Appartment of OM Shri Jigar Association constructed on land bearing Survey No. 587/1/A/B paiki (Final plot no 287 of town planning scheme no 15) Plot No. 287/B (City Survey No. 2926 paiki) of Mouje-Vadaj, Taluka-Ahmedabad west in the district of Ahmedabad and registration sub district of Ahmedabad-2 (Vadaj) Within the state of Gujarat standing in the name of Mr. Bharat Parsottamdas Panchal. The bounded are the property are : East Other Property, West : Passage, North : Block A, South : Open space Date : 04.12.2021 Authorised Officer Place : Ahmedabad Indian Bank

AU SMALL FINANCE BANK LIMITED (A Scheduled Commercial Bank) AU SMALL FINANCE BANK Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381) APPENDIX IV [SEE RULE 8(I)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank) under the 'Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act, 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrowers to repay the amount mentioned in the said notice within 60 days from the date of receipt of the said notice as per the details given in below table: -



Regd. Office: Baroda - Godhra Highway, Kalol (Panchmahals), Pin Code - 389 330, Gujarat, India Phone: 02676-270600, Fax: 02676-235524, E-mail: investor.relations@setcoauto.com; Website: www.setcoauto.com, CIN: L35999GJ1982PLC005203

NOTICE OF THE 38[™] ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 38" Annual General Meeting ("AGM") of Setco Automotive Limited ("the Company") will be held on Wednesday, 29" December, 2021 at 02.30 p.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") in accordance with the General Circular No. 20/2020 dated 05" May, 2020 read with General Circular No. 14/2020 dated 08" April, 2020 and General Circular No. 17/2020 dated 13" April, 2020 and General Circular dated 02/2021 dated 13" January, 2021 issued by the Ministry of Corporate Affairs ("MCA") ("Collectively referred to as MCA Circulars") and SEBI Circular dated 12" May, 2020 and 15" January, 2021 to transact business set out in the Notice calling the AGM dated 04th December, 2021.

In compliance with the said MCA and SEBI Circulars, the Company has sent the Notice of the AGM and Annual Report 2020-21 on Tuesday, 07th December, 2021 through electronic mode only, to those members who have registered their e-mail addresses with the Company/Registrar and Transfer Agent ("RTA")/Depository Participants ("DP"). These documents are also available on Company's website www.setcoauto.com and on the website of the Stock Exchange i.e. BSE Limited ("BSE") and the National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and on website of Central Depository Services India Limited ("CDSL") at www.evotingindia.com

In accordance with Section 108 of the Companies Act 2013 read with Companies (Management and Administration) Rules, 2014 and Secretarial Standard-2 on General Meeting and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations, 2015"), as amended from time to time, the Company is providing facility to its members holding shares as on Wednesday, 22" December, 2021, being cut-off date, to exercise their right to vote on all resolutions set forth in the Notice of the AGM. The members may cast their vote using an e-voting system ("Remote e-voting") or by e-voting at the AGM. The Company has engaged CDSL to provide Remote e-voting facility and e-voting facility at the AGM. The detailed procedure/instructions for e-voting are contained in the 38" AGM Notice.

In this regard the Members are hereby further notified that:

- The Company has completed the dispatch of Notice at 38" AGM along with the Annual Report 2020-21 on Tuesday, 07" December 2021. (a)
- (b) Remote e-voting through electronic means shall commence from Sunday, 26th December, 2021 (9:00 a.m.) and end on Tuesday, 28th December, 2021 (5:00 p.m.). Remote e-voting through electronic means shall not be allowed beyond 5:00 p.m. on Tuesday, 28" December, 2021.
- (C) Cut-off date for the purpose of e-voting shall be Wednesday, 22[™] December, 2021.
- (d) Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice and holds shares as on the Cut-off Date, may obtain the login-id and password for remote e-Voting by sending a request at helpdesk.evoting@cdslindia.com or may contact on telephone no. 022-23058543. A person who is not a Member as on the Cut-off Date should treat the Notice of the AGM for information purposes only.
- (e) Members present at the meeting through VC/OAVM facility and who has not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not debarred from doing so, shall be eligible to vote through e-voting systems during the AGM. The detailed instructions for attending the AGM through VC/OAVM are provided in the Notice of the AGM.
- (f) Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM facility but shall not be allowed to cast their votes again.
- A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the (g) cut-off date only shall be entitled to avail of the facility of remote e-voting as well as e-voting during the AGM.
- (h) The manner of registration of email addresses of those members whose email addresses are not registered with the Company/RTA/DP is available in the AGM Notice.
- (i) The details of Scrutinizer and procedure for Speaker Registration are provided in the AGM Notice.

In case of any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact

Name of Borrower/Co-Borrower/ 13(2) Notice Mortgagor/Guarantor/Loan A/c No. Date & Amount		Description of Mortgaged Property	Date of Possession Taken	
(Loan A/C No.) L9001060100103273, Dhavalbhai Mansukhbh (Borrower), Shilpaben Dhavalbhai Ribadiya (Co- Borrower), Mansukhbhai Haribhai Ribadiya (Co-Borrower), Manjulaben Mansukhbhai Ribdiya (Co-Borrower)	16-Aug-21 ₹ 22,54,287/- Rs. Twenty-Two Lac Fifty- Four Thousand Two Hundred Eighty-Seven Only As On 16-Aug-21	Property Situated At Ranuja Trading Shop No. 1, Marketing Yard Junagadh Road, Gujarat. Admeasuring 800 Sq Yd	4-Dec-21	
(Loan A/C No.) L9001060119815121, Mahakali Sales (Borrower), Dhirubhai Nathabhai Gujariya (Co-Borrower), Vishnubhai Nathabhai Gujariya (Co- Borrower), Nathabhai Hirabhai Gujariya (Co-Borrower) Monghiben Nathabhai Gujariya (Co-Borrower)16-Aug-21(Loan A/C No.) L9001060115278409, Vaghasia Mukeshbhai Ranchhodbhai (Borrower), Vaghasiya Kantaben Ranchhodbhai (Co-Borrower), Vaghasia Rashmiben Mukeshbhai (Co- Borrower)16-Sep-21₹ 47,08,301/- Rs. Forty- Seven Lac Eight Thousand Three Hundred One Only As On 14-Sep-21		Property Situated At Municipal Corporation Sini Bazar Road Mochi Chowk Old Vegetable Market, Nagarvada Bhavnagar Mahuava, Gujarat .Admeasuring 88 Sqyds	2-Dec-21	
		Property Situated at Freehold - Within Municipal Limit "Rajeshri" Mayur Nagar Satyam Shivamvali Street Rajkot Dhoraji, Gujarat. Admeasuring 5508000 Sqyds	4-Dec-21	

The borrower having failed to repay the amount, therefore notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act 2002] read with Rule 8 of the said rule on the date mentioned in the above table.

Borrower & Co-Borrower, Guarantor Name	Description Of The Immovable Property	Loan A/C No Date of Possesion	Date & Amount of Demand Notice		Branch, Nadiad, Mrs Preeti Suman, Senior + In	Interest + A	Gujarat - 387002 R.S. No. 29 Paiki, Industrial Areas/Estate, Nadiad, Admeasuring Area 85.56 Sq. Mtr. Bounded By:-East: 6 Meter Aproach Road, Nest: Plot No. D/35, North: Plot No. D/47, South: Plot No. D/45.	Rs. 1,24,800/-																								
Shree Hiteshbhai Maheshbhai Solanki (Applicant) Bhavnaben Hiteshbhai Solanki (Co-Applicant)	All That Piece And Parcel of Property Bearing Plot No.137(b-type),(as Per Kjp Block No.182b/paiki- 137) Admeasuring About 71.81 Sq.mtrs & Undivided Share of Land & Road Cop 50.26 Sq. Mtrs Total Admeasuring 122.07 Sq. Mtrs &	Loan Account No : 4187 03-12-2021	No: 4187 03-12-2021	No: 4187	2: 4187 Thirty Four Thousands Eight Hundreds Ninety Two Rupees	5.	(Santram Road Branch, Nadiad, Mrs Preeti Suman, Senior Manager, Mob : +91 6358815892) + Ir	19,91,408/- Interest +	Equitable Mortgage of Property in the Name of Mr. Vijaykumar Tijram Choukse, situated at Plot No. F/12, Karmvir Sundervan- III, Near Karmvir Sundervatika, Manjipura Road, Nadiad, Taluka - Nadiad, Distt - Kheda, Gujarat, Survey No. 26, ndex No. 1856, Admeasuring 44.00 Sq.Mtr. Bounded By :- East : Plot No. F/65, West : Approach Road, North : Plot No. F/13, South : Plot No. F/11.	Rs. 11,58,000/- Rs. 1,15,800/-																						
	Construction Thereon, in The Scheme of "ramdut Residency " Situated At Survey No.335, block No. 182 Paiki Khata No.43, Admeasuring 11382 Sq. Mtrs., At. Syadla, Ta. Olpad, In The Registration District & Sub District of Surat, Gujarat.			6.	M/s. Sahyog Plastic, Mrs. Ranjanben Ashokbhai Thakker (Proprietor, Guarantor & Mortgagor) (Gulbai Tekra Branch, Ahmedabad, Mr. Vinay Shankhdhar, Authorised Officer, Mob No : 09909928880)	,008/- Plot An t + in the s rges Survey No. 15	ble Mortgage of Property in the name of Mrs. Ranjanben Ashokbhai Thakker g Shed No. 7, 8, 9, Super Plot Area 386.69 Sq. Mtrs (205.69 Sq. Mtrs. Actual ea + 181 Sq. Mtrs Undivided Interest In Common Road and Common Plot etc) scheme Golden Industrial Estate, At Mouje – Dhanot, Survey Block No. 156, Block No. 157, Survey Block No. 158, Survey Block No. 158, Survey Block 9, Survey Block No. 160 & Survey Block No. 161, Taluka – Kalol, District - hinagar, Admeasuring Area 117.05 Sq. Mtr.	Rs. 47,30,000/- Rs. 4,73,000/-																								
Lavlesh Babulal Kol (Applicant) Lalaniyadevi Lavlesh Kol (Co-Applicant)	All That Piece And Parcel of Property Bearing Plot No.31,admeasuring 40.18 Sq.mtrs. Alongwith Undivided Share 27.51 Sq. Mtrs In Road & Cop Totally 67.69 Sq. Mtrs., In Scheme Known As "shrungal Homes" Situated At Revenue Survey	h No : 4268 s 03-12-2021 i, 2 n	Hundreds Eight Rupees Only)	7.	Ramjibhai Prajapati (proprietor & Mortgagor) (Gulbai Tekra Branch, Ahmedabad, Rs. Mr. Vinay Shankhdhar, Authorised Officer, +	06.06.2019 . 1,55,92,129/- + Interest + Other Charges	Equitable Mortgage of the Property in the name of Mr. Chiragkumar Ramjibhai Prajapati, Godown situated at 75, "Shree Ramdev Ware Housing Godown", Nr. Jaliyana Warehousing Godown, R.S. No. 155, Harij – Becharaji Highway, Mouje : Vaghel, Tal : Harij & Dist: Patan. Area 83.87.50 Sq. Mtr. Bounded as Under : East : 7.50 Meter Vide Internal Road of Society, North : Plot No. 74, West : Plot No. 82, South : Plot No. 76.	Rs. 2,94,000/- Rs. 29,400/-																								
	No.76/paikki & 96/1 Paikki & 75/pakki & 95 Paikki, Block No.343/a & 343/b Total Admeasuring 46842 Sq. Mtrs. At.bharudi,ta. Olpad,in The Registration District of Surat, Gujarat.			8.	Mr. Parthiv Dhirajlal Kotak), Mr. Montukumar Dhirajlal Kotak (Thakkar) – Guarantor and Mr. Dhirajlal Narbheram Thakkar – Guarantor + Int	12.2010 H 18,29,576/- 0 Interest + 0	I) Equitable Mortgage of Property in the name of Mr. Montukumar Dhirajlal Kotak, Commercial Shop No. 341, Third Floor, Adm. 11.61 Sq. Mts., Ratnamani Complex of Tej Developers and Rajiv Developers, Near Nagar Seth No Vando, Gheekanta, Ahmedabad, Constructed on bearing City Survey No. 1653/1/A, 1680 and 1681/A/1, Mouje Shahpur-2, Taluka City, District and Sub District -	Rs. 4,79,000/- 																								
Dinesh Mangilal Vishwakarma (Applicant) All That Piece And Parcel of Property Bearing Plot No.32 Admeasuring Sq. Mtrs. 40.18 Alongwith	LuanAucount	Rs.1,030,523.00 (Ten Lakhs	Rs.1,030,523.00 (Ten Lakhs Thirty Thousands Five		Mr. Sujan Singh, Senior Manager, Mobile No : 07567883837)	4	Ahmedabad, Gujarat. Bounded By :- East : Office No. 313, West : Common Wall with Office No. 314, North : Road, South : Common Stair.	Rs. 47,900/-																								
Balibai Mangilal (Co-Applicant)	Undivided Share 27.51 Sq. Mtrs In Road & Cop Totally 67.69 Sq. Mtrs And Construction Thereon In Scheme Known As "shrungal Homes " Situated At Revenue Survey No. 76/p , 96/1 P, 75/p, Block No.	03-12-2021	03-12-2021	03-12-2021	and and a	Hundreds Twenty Three Rupees Only) Date 15/05/2021.	Hundreds Twenty Three Rupees	Hundreds Twenty Three Rupees	Hundreds Twenty Three Rupees	Hundreds Twenty Three Rupees	Hundreds Twenty Three Rupees			Hundreds Twenty Three Rupees		Mts., Ratnamani Complex of Tej Developers and Rajiv	v Developers, N Shahpur - 2, Ta	nirajlal Kotak, Commercial Shop No. 441, Fourth Floor, Admeasuring 11.61 Sq. Near Nagar Seth No Vando, Gheekanta, Ahmedabad, Constructed on bearing Juka City, District and Sub District - Ahmedabad, Gujarat. Bounded By :- East : ad, South : Common Stair.	Rs. 4,46,000/- Rs. 44,600/-													
	343/a, 343/b Admeasuring 46,842 Sq. Mtrs., At. 3harundi, Ta. Olpad, In The Registration District & Sub District Of Surat, Gujarat.				Last Date & Time of Submission of	f EMD and I	21.12.2021 between 12.00 Noon to 2.00 PM Documents (Online) On or Before : 27.12.2021 Up to 4.00 PN .00 PM to 6.00 PM with Auto Extension of 10 Minutes	Λ.																								
Date : 08-12-2021 Place : Surat		· · · · · · · · · · · · · · · · · · ·	Bharat J. Bhatt (M.) 9714199018 ng & Mortgage Finance Ltd.	Wal prov Res	s://www.mstcecommerce.com and upload KYC docu let through NEFT /RTGS/transfer (after generation of chi rided in www.cantralbankofindia.co.in or auction p	uments and aft hallan from htt platform https	service provider https://www.mstcecommerce.com. Bidder will register verification of KYC documents by the service provider, EMD to be deposit ps://www.mstcecommerce.com). For detailed terms and conditions pleas s://www.mstcecommerce.com. Helpline No. 033-22901004 or Respected adabad, Mr. Manoj Kumar Thakur, Authorized Officer, Contact No: 63587	ed in Global EMD se refer to the link ctive Branch or																								
								ed creditor. Sd/-, Authorised Officer, ntral Bank of India																								

Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).

In case of any further queries or grievances pertaining to the e-voting procedure, shareholders may get in touch with Mr. Hiren P. Vala, Company Secretary, by writing an email on investor.relations@setcoauto.com or may contact on telephone no.022 - 40755555.

> By order of the Board of Directors For Setco Automotive Limited

> > Hiren P. Vala

Place: Kalol Date: December 07, 2021

Company Secretary

सेन्ट्रल क्षेंक ओक धन्डिया सेन्ट्रल बैंक ओफ इंडिया CENTRAL BANK OF INDIA	Regional Office, Lal Darwaja, Ahmedabad-380001.	APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] Sale Notice for Sale of Immovable Properties	E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.
--	---	---	--

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor, the Physical Possession of which have been taken by the authorized officer of Central Bank of India, Secured creditors, will be sold on "As is where is", "As is what is" and "whatever is there is" on date 28.12.2021 for recovery of due to the Central Bank of India from Borrower(s) and Guarantor(s). The Reserve Price and earnest money deposit (EMD) is displayed against the details of respective properties.

	n the above table. visions of sub section (8) of section 13 of the Act, in respect of time ic in general is hereby cautioned not to deal with the property			Sr.		Demand Notic		Reserve Price
charge of the AU Small Finance Bank Limi	ited (A Scheduled Commercial Bank) for the amount and intere			No.	Guarantors/Mortgagers and Contact Detail of Branch	Date & Due Amount	t	10% EMD
Date : 07/12/2021 Place : Ahmedabad Authorised Officer AU Small Finance Bank Limited					Subhashchandra Kailashbhai Kansara & Mrs. Pujaben Subhashchandra Kansara (borrower & Mortgager) (Pij Branch, Kheda Dist., Mr. Sevakram Motiyani, Senior Manager, (M) : 8980015890)	11.12.2018 Rs. 24,70,727 + Interest + Other Charges	reaction and the second and the seco	Rs. 14,96,000/- Rs. 1,49,600/
MAS RURAL HOUSING & N FINANCE LIMITED Narayan Chambers, 2th Floor, B/h, Pata Ahmedabad-380009, Contact : 079-4110 Whereas the undersigned being th	NORTGAGE POSSE ing Hotel, Ashram Road. (FOR IMMOVABLE PROPERTY) Rule e authorized officer of the MAS Rural Housing & Mo		y Interest (Enforcement Rules 2002)	2.	M/s. Siddhi Industries (Borrower), Mr. Praka Chamnaji Singhal (Partner), Mr. Mohanji Radh (Partner & Mortgagor), Mr. Rajeshbhai Jethala (Guarantor & Mortgagor) (Gulbai Tekra Br Ahmedabad) (Mr. Vinay Sankhdhar Authorised Officer, Contact No. 0990992	nuji Thakor al Thakkar ranch, 9, r, 4	01.08.2019 Residential Row House At : Plot No. 26, Akshar Homes Vibhag B, Revenue Block No. 1172 Paiki, Survey No. 720/1, 773/3, Jornang, Mehsana. Plot Area 121.53 Sq.mtrs, Construction 108 Sq.mtrs. Alongwith Undivided share in the land of the scheme in the Name of Mohanji Radhuji Thakore. Bounded as :- East : Block No. 1173, West : Internal Road, North : House No. 27, South : House No. 25.	Rs. 11,48,000/- Rs. 1,14,800
Reconstruction of Financial Assets a 13(12) read with rule 3 of the Securit borrower/Guarantor to repay the amo The Borrower having failed to repay undersigned has taken Symbolic Po section 13 of the said [Act] read with R The Borrower/Co-borrower/Guaranto	nd Enforcement of Security Interest Act - 2002 (54 of 2002 ty Interest (Enforcement) Rules, 2002 issued a demand rount mentioned in the notice being within Sixty Days from the the amount, notice is hereby given to the Borrower/Co-b ssession of the property described herein below in exercise Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, a or in particular and the public in general is hereby caution rge of the MAS Rural Housing & Mortgage Finance Ltd.	2) and in exerci- notice as below e date of receip forrower/Guara se of powers con- s below details. ed not to deal w	ise of powers conferred under section details calling upon the Borrower/Co- t of the said notice. ntor and the public in general that the inferred on him under sub-section (4) of with the property and any dealings with	3.	Mrs. Binalben Purveshbhai Thakkar (Borrower & Mortgagor) & Mr. Purvesh Kiritkumar Thakkar (Co- Borrower) (S M Road Branch, Ahmedabad, Mr. Roushan Kumar, Authorised Officer, Mobile No: 9909948868)	507, on Fifth Undivided Lar known as "Shr Total Admeasi Revenue Surv Taluka : Vatva Within State C	tgage of property in the name of Binalben Purveshbhai Thakkar Bearing Flat/ Unit No. Floor Admeasuring 38.97 Sq. Mtrs. or Thereabout (Built Up Area) Together with ad Share Admeasuring 15.43 Sq. Mtrs. Provided in the Entire Land of The Scheme reenath Heights" Constructed Upon Non Agricultural Land Bearing Final Plot No: 22/2 uring 910 Sq. Mtrs. or Thereabout Of Town Planning Scheme No.80 Alloted In Lieu Of ey No. 457/3 Admeasuring 1518 Sq. Mtrs, Being, Lying And Situated Mouje : Vatva, Within The Registration Sub District Ahmedabad-11 (Aslali) Of District Ahmedabad Of Gujarat Together With All Rights And Appurtenances Which Is Bounded As Under: 506, West : Open Area, North : Lift, South : 40' Wide Road.	Rs. 9,62,000/- Rs. 96,200,
The Borrower/Co-borrower/Guarante	or attention is invited to provisions of sub-section (8) of			4.	Mr. Manishkumar Maheshbhai Makwana (Borrower) & Mrs. Meenaben Maheshbhai	05.03.201	8 Equitable Mortgage of Property in the name of Mr. Manishkumar Maheshbhai Makwana, D/46, Karmavir Sundervan, Manjipura, Tal- Nadiad, District- Kheda,	Rs.
redeem the secured assets. Borrower & Co-Borrower, Guarantor Name	Description Of The Immovable Property	Loan A/C No Date of Possesion	Date & Amount of Demand Notice		Makwana (Co-Borrower) (Santram Road Branch, Nadiad, Mrs Preeti Suman, Senior Manager, Mob : +91 6358815892)	Rs. 9,65,33 + Interest Other Charg	3/- Gujarat - 387002 R.S. No. 29 Paiki, Industrial Areas/Estate, Nadiad, + Admeasuring Area 85.56 Sq. Mtr. Bounded By :- East : 6 Meter Aproach Road,	12,48,000/- Rs. 1,24,800
Bhavnaben Hiteshbhai 137) Admeasuring About 71.81 Sq.mtrs & Solanki (Co-Applicant) Undivided Share of Land & Road Cop 50.26 Sq. 03-12-202	Loan Account No : 4187 03-12-2021	Thirty Four Thousands Eight Hundreds Ninety Two Rupees	5.	Mr. Vijaykumar Tijram Choukse (Borrower) (Santram Road Branch, Nadiad, Mrs Preeti Suman, Senior Manager, Mob : +91 6358815892)	01.09.201 Rs. 19,91,40 + Interest Other Charg	 situated at Plot No. F/12, Karmvir Sundervan- III, Near Karmvir Sundervatika, Manjipura Road, Nadiad, Taluka - Nadiad, Distt - Kheda, Gujarat, Survey No. 26, Index No. 1856, Admeasuring 44.00 Sq.Mtr. Bounded By :- East : Plot No. 	Rs. 11,58,000, 	
	Mtrs Total Admeasuring 122.07 Sq. Mtrs & Construction Thereon, in The Scheme of "ramdut Residency " Situated At Survey No.335, block No. 182 Paiki Khata No.43, Admeasuring 11382 Sq. Mtrs., At. Syadla, Ta. Olpad, In The Registration District & Sub District of Surat, Gujarat.			6.	Ashokbhai Thakker (Proprietor, Guarantor & Mortgagor) (Gulbai Rs. 1, Tekra Branch, Ahmedabad, Mr. + 1	,59,08,008/- Interest + her Charges	Equitable Mortgage of Property in the name of Mrs. Ranjanben Ashokbhai Thakker bearing Shed No. 7, 8, 9, Super Plot Area 386.69 Sq. Mtrs (205.69 Sq. Mtrs. Actual Plot Area + 181 Sq. Mtrs Undivided Interest In Common Road and Common Plot etc) in the scheme Golden Industrial Estate, At Mouje – Dhanot, Survey Block No. 156, Survey Block No. 157, Survey Block No. 158, Survey Block No. 158, Survey Block No. 159, Survey Block No. 160 & Survey Block No. 161, Taluka – Kalol, District – –Gandhinagar, Admeasuring Area 117.05 Sq. Mtr.	Rs. 47,30,000, Rs. 4,73,00
(Applicant) No.31,admeasuring 40.18 Sq.mtrs. Alongwith Undivided Share 27.51 Sq. Mtrs In Road & Cop	No: 4268	Hundreds Eight Rupees Only)	7.	M/s. Murlidhar Trading, Mr. Chiragkumar Ramjibhai Prajapati (proprietor & Mortgagor) (Gulbai Tekra Branch, Ahmedabad, Mr. Vinay Shankhdhar, Authorised Officer, Mob No : 09909928880)	Rs. 1,55,92	Ramjibhai Prajapati, Godown situated at 75, "Shree Ramdev Ware Housing Godown", Nr. Jaliyana Warehousing Godown, R.S. No. 155, Harij – Becharaji Highway, Mouje : Vaghel, Tal : Harij & Dist: Patan. Area 83.87.50	Rs. 2,94,000/ Rs. 29,400	
	No.76/paikki & 96/1 Paikki & 75/pakki & 95 Paikki, Block No.343/a & 343/b Total Admeasuring 46842 Sq. Mtrs. At.bharudi,ta. Olpad,in The Registration District of Surat, Gujarat.		N N	M/s Kotak Agency (Through its proprietor Mr. Parthiv Dhirajlal Kotak), Mr. Montukumar Dhirajlal Kotak (Thakkar) – Guarantor and Mr. Dhirajlal Narbheram Thakkar –Guarantor (Sola Road Branch, Ahmedabad,	13.12.2018 Rs. 28,29,57 + Interest Other Charge	 Kotak, Commercial Shop No. 341, Third Floor, Adm. 11.61 Sq. Mts., Ratnamani Complex of Tej Developers and Rajiv Developers, Near Nagar Seth No Vando, Gheekanta, Ahmedabad, Constructed on bearing City Survey No. 1653/1/A, 	Rs. 4,79,000/-	
)inesh Mangilal Vishwakarma Applicant)	NA 31 Adda a source of the Alter All 40 Also access	LuanAucount	.oan AccountRs.1,030,523.00 (Ten LakhsNo: 4312Thirty Thousands FiveHundreds Twenty Three Rupees03-12-2021Only) Date 15/05/2021.	Mr. Sujan Singh, Senior Manager, Mobile No : 07567883837)		Ahmedabad, Gujarat. Bounded By :- East : Office No. 313, West : Common Wall with Office No. 314, North : Road, South : Common Stair.	Rs. 47,900/	
Balibai Mangilal (Co-Applicant)	Undivided Share 27.51 Sq. Mtrs In Road & Cop Totally 67.69 Sq. Mtrs And Construction Thereon In Scheme Known As "shrungal Homes " Situated At Revenue Survey No. 76/p , 96/1 P, 75/p, Block No.	03-12-2021			Mts., Ratnamani Complex of Tej Developers an	nd Rajiv Develo , Mouje Shahpu	mar Dhirajlal Kotak, Commercial Shop No. 441, Fourth Floor, Admeasuring 11.61 Sq. opers, Near Nagar Seth No Vando, Gheekanta, Ahmedabad, Constructed on bearing r - 2, Taluka City, District and Sub District - Ahmedabad, Gujarat. Bounded By :- East : th : Road, South : Common Stair.	Rs. 4,46,000 Rs. 44,600/
	343/a , 343/b Admeasuring 46,842 Sq. Mtrs., At. Bharundi, Ta. Olpad, In The Registration District & Sub District Of Surat, Gujarat.				Last Date & Time of Submiss	sion of EMD	me : 21.12.2021 between 12.00 Noon to 2.00 PM and Documents (Online) On or Before : 27.12.2021 Up to 4.00 PM me: 2.00 PM to 6.00 PM with Auto Extension of 10 Minutes	Л.
Date : 08-12-2021 Place : Surat			Bharat J. Bhatt (M.) 9714199018 ng & Mortgage Finance Ltd.	Walle	The auction will be conducted through the s://www.mstcecommerce.com and upload K et through NEFT /RTGS/transfer (after generation ded in www.cantralbankofindia.co.in or au	he Bank's app YC documents ion of challan fro uction platform	and after verification of KYC documents by the service provider, EMD to be deposi om https://www.mstcecommerce.com). For detailed terms and conditions pleas https://www.mstcecommerce.com. Helpline No. 033-22901004 or Respe Ahmedabad, Mr. Manoj Kumar Thakur, Authorized Officer, Contact No: 63587	ted in Global EN se refer to the li ctive Branch
				office	e hours on any working days. STATUTORY	Y 15 DAYS SAL	E NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002 sale of immovable secured assets towards realization of outstanding dues of secur	









કાયનાન્સિયલ એક્સપ્રેસ

CIN: U24110MH1993PLC070713 Regd. Off: Kalpataru Square, 4th Floor, Kondivita Road, Off Andheri Kurla Road, Andheri (E), Mumbai - 400059 Ph. No.: 022-66637373. Fax No.: 022-28322272 E-mail: info@indofil.com Website: www.indofil.com Notice

(For the kind attention of Shareholders of the Company)

INDOFIL INDUSTRIES LTD

Sub: Transfer of Unclaimed Right Issue amount of the Company to Investor Education and Protection Fund (IEPF)/ IEPF Suspense Account

This notice is published in pursuance to the provisions of Section 124 of Companies Act, 2013 and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016, as amended ("the Rules"). The Rules, amongst other matters, contain provisions for transfe of unpaid amount of Rights Issue refund amount to the Investor Education and Protection Fund (IEPF) Authority. Adhering to the various requirements set out in the Rules.

The Investor may note that in case the Company does not receive any communication from the concerned Investor by December 12, 2021, the Company shall, transfer unpaid refund amount to IEPF Shareholders may note that the unclaimed refund amount transferred to IEPF/ IEPF Suspense Account can be claimed back by the concerned investor from IEPF Authority by making an application in IEPF-5 as prescribed under the Rules. As per the above mentioned rules, only one such request can be made in one year

In case the shareholders have any queries on the said matter and the Rules, they may contact: Mr. O P Joshi, M/s Mas Services Limited, Unit: Indofill Industries Limited , T-34, 2rd Floor, Okhla Industrial Area, Phase - II, New Delhi - 110020, Ph:-011 26387281/82/83, Fax:-011 26387384 mail:- info@ma serv.com, Website: www.masserv.com s Limite

	For Indotil Industries Limited
	Sd/-
	Devang Mehta
Place: Mumbai	Head - Company Secretary & Legal
Date: 7 December, 2021	Membership No - 8930

CORRIGENDUM

This corrigendum is for intimation purpose only and not for publication, distribution or release directly or indirectly outside India. Not for release in the United States. This is not an announcement for the offer document. All capitalized terms used and not defined herein shall have the same meaning assigned to them in the letter of offer dated September 13, 2021 (the "Letter of Offer" or "LOF") filed by Kesoram Industries Limited (the "Company") with BSE Limited ("BSE"). National Stock Exchange of India Limited ("NSE") and The Calcutta Stock Exchange Limited ("CSE" and together with BSE and NSE, "Stock Exchanges") and the Securities and Exchange Board of India ("SEBI").



KESORAM INDUSTRIES LIMITED

Registered Office and Corporate Office: 9/1 R.N. Mukheriee Road Kolkata 700 001, West Bengal, India. Tel: +91 33 2243 5453; Contact person: Raghuram Nath, Company Secretary and Compliance Officer, E-mail: corporate@kesoram.net: Website: www.kesocorp.com Corporate Identity Number: L17119WB1919PLC003429

This is a corrigendum to the newspaper advertisement published on December 7, 202 ("Newspaper Advertisement") regarding First and Final Call Notice to the holders o partly paid-up Equity Shares (ISIN: IN9087A01017) of the Company held as on the First and Final Call Record Date i.e. Thursday, December 2, 2021.

The corrigendum should be read in continuation of and in conjunction with the Newspaper Advertisement and the First and Final Call Notice. All other contents of the Newspaper Advertisement, save and except as modified by the corrigendum, shall remain unchanged As mentioned in "Details of First and Final Call" -> Modes of Payment -> (d)

Cheque / Demand Draft (made payable to) -> Account details shall be replaced							
	and read as under:						
Modes of	s of (d) Cheque / a. Kesoram Industries Limited Call Money-R A/c						
Payment	Demand Draft	(for resident Eligible Shareholders)					
-	(made payable	b. Kesoram Industries Limited Call Money-NR A/c					
	to) (for non- resident Eligible Shareholders)						
This corrig	endum notice is	also available on the website of the Company					
www.kesoco	www.kesocorp.com.						
Date : December 7, 2021 For KESORAM INDUSTRIES LIMITED							
Place : Kolkata S							
		Raghuram Nath					

Company Secretary & Compliance Officer



આથી સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ના નિચમ ૮ અને ૯ સાથે વંચાતી કલમ ૧૩ (૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંકના** અધિકૃત અધિકારીએ cl. ou.ox.૨૦૨૧ ના રોજ માંગણા નોટિસ ભારી કરી અમારી નારણપુરા શાખા સાથે એકાઉન્ટ ધરાવતા દેવાદાર **શ્રી રમેશ અંબાલાલ તુરી (દેવાદાર) અને શ્રીમતી હંસાબેન** રમેશ તુરી (સહ-દેવાદાર) અને શ્રી સોલંકી હર્ષદકુમાર નંદલાલ (જામીનદાર) અને શ્રી રાજેશ શામલદાસ સોલંકી (જામીનદાર)ને માંગણા નોટીસમાં જણાવેલ ૨કમ 3ા. ૨૪.૪૧.૯૨૪/- (3ા. ચોવીસ લાખ એકતાળીસ હજાર નવસો ચોવીસ પરા) (હોમ



ચોવીસ લાખ બે હજાર આઠસો ચોર્ચાશી અને સોળ પૈસા પુરા) તા. ૦૯.૦૮.૨૦૨૧ **મુજબ** અને તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચાઓ જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું . દેવાદારો / જામીનદારો / ગીરવેદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદારો /

જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિયમોના નિયમ ૩,૮,૯ સાથે વંચાતી કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દશવિલી મિલક્તનો **તારીખ ૦૩.૧૨.૨૦૨૧ ના રોજ કબજો** લઈ લીધો છે.

આથી ખાસ કરીને દેવાદારો / જામીનદારો / ગીરવેદાર અને જાહેર જનતાને મિલક્ત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલક્ત સાથેનો કોઇપણ સોદો **ઇન્ડિચન બેંક (અગાઉ અલાહાબાદ બેંક), રિલીક રોડ શાખા**ની ૨કમ ૩ા. ૨૪.૦૨.૮૮૪.૧૬ (૩પિયા ચોવીસ લાખ બે હજાર આઠસો ચોર્ચાશી અને સોળ પૈસા પુરા) **તા. ૦૯.૦૮.૨૦૨૧ મુજબ** વત્તા તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચા વગેરેના ચાર્જને આદ્યિન રહેશે.

સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે કાચદાની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

શ્રી અનિલ દત્તાત્રેય શિવાલેકરના નામે મોજે ૨ખિચાલ, તાલુકા અમદાવાદ સિટી (પૂર્વ), ૨જીસ્ટ્રેશન જલ્લા અમદાવાદ અને ૨જીસ્ટ્રેશન ઉપ જીલ્લા અમદાવાદ-૭(ઓઢવ), ગુજરાત રાજ્યના સર્વે નં. ૯૭/૧ પૈકી, ટી.પી.સ્કીમ નં. ૧૨ ના એફ.પી.નં. ૧૭૧ પૈકી ૧૬૮૦ ચો.વાર માપના સબ પ્લોટ નં. ૪/બી ધરાવતી એન.એ. જમીન પર રહેલ ન્યૂ અરવિંદનગર કો. ઓપ. હાઉસીંગ સોસાચટી લિ. વિભાગ ૨ તરીકે જાણીતી સ્કીમમાં સંદાજાત ૨૧૯ ૨૦ સો મી માપનો બાંધકામ વિસ્તાર ધરાવતા ટેનામેન્ટ નં ૧૯ ખાતે સ્થિત રહેણાંક સ્થાવર મિલકતના બધા પીસ અને પાર્સલ. **ચતુઃસીમા : ઉત્તર :** ટેનામેન્ટ નં. ૧૭, **દક્ષિણ :** ટેનામેન્ટ નં. ૧૫, **પૂર્વ :** સોસાચટી રોડ , **પશ્ચિમ** : ટેનામેન્ટ નં. ૩૬ ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી તારીખ : ૦૩.૧૨.૨૦૨૧ ઈન્ડિયન બેંક વતી સ્થળ : અમદાવાદ

નારણપુરા શાખા, ાગર ચાર રસ્તા, અમદાવાદ, इंडियन बैंक 🔊 Indian Bank ગુજરાત-૩૮૦૦૧૩ 🛆 इलाहाबात ALLAHABA કોન: ૦૯૯-૨૯૪ ૦૬૮૧, ફેક્સઃ ૦૭૦ પરિશિષ્ટ-૪ (નિચમ ૮(૧)) હેઠળ કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી સિક્યોનીટાઇઝેશન એન્ડ નીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ ਐਕੀਸੀਅਣ ਅੀਤ ਸਿਤਬੀਦੀਟੀ ਪਿਛਦੇਲਟ ਐਤਟ 2002 ਫੈਨਯ ਅੱਗੇ ਸਿਤਬੀਦੀਟੀ ਪਿਛਦੇਲਟ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી કલમ ૧૩ (૨) હેઠળ પ્રાપ્ત સત્તાની ૩એ નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંકના** અધિકત અધિકારીએ **તા. ૦૮.૦૪.૨૦૨૧ ના રોજ** માંગણા નોટિસ જારી કરી અમારી નારણપુરા શાખા સાથે ટર્મ લોન અને ઓસીસી લિમિટ એકાઉન્ટ ધરાવતા દેવાદાર **મે. પુનમ ઇન્ડસ્ટ્રીઝ વર્ક્સ** (પ્રોપરાઈટરશીપ ફર્મ અને દેવાદાર) અને શ્રી ભરત પરસોત્તમદાસ પંચાલ (મે. પુનમ ઈન્ડસ્ટ્રીઝ વર્ક્સના પ્રોપરાઈટર અને ગીરવેદાર) અને શ્રી ધિરજભાઈ ખેમચંદભાઈ પંચાલ (જામીનદાર)ને નોટીસમાં જણાવેલ ૨કમ રા. ૩૯,૭૧,૬૧૩.૭૬ (રૂપિયા ઓગણચાલીસ લાખ ઈકોતેર હજાર છસો તેર અને છોત્તેર પૈસા પુરા) (ટર્મ લોનની બાકી સ્કમ રૂા. ૧૪,૬૫,૩૩૫.૯૮ + એમઓઆઈ બાકી રૂા. ૨,૦૧,૧૬૨.૧૮ કુલ રૂા. ૧૬,૬૬,૪૯૮.૧૬ અને ઓસીસી લિમિટની બાકી રકમ રૂા. ૨૦,હ૧,૧૫૬.૪૯ + એમઓઆઈ બાકી રા. ૨,૩૩,૯૫૯.૧૨ કુલ રા. ૨૩,૦૫,૧૧૫.૬૦ કુલ સરવાળો રા. ૩૯,७૧,૬૧૩.७૬) @ **૮.૩૦%) તા. ૦૩.૧૨.૨૦૨૧** થી ચૂક્વણીની તારીખ સુધી તેની પરના વ્યાજ સહીત જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું . દેવાદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદાર અને જાહેર જનતાને આ

નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિચમોના નિચમ ૮ અને ૯ સાથે વંચાતી કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને પ્રાપ્ત સત્તાની ૩એ નીચે દર્શાવેલી મિલક્તનો **તારીખ ૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ કબજો** લઈ લીધો છે. આથી ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો **ઇન્ડિયન બેંક**ની ૨કમ રૂા. ૩૯,હ૧,૬૧૩.હ૬ (રૂપિયા ઓગણચાલીસ લાખ ઈકોતેર હજાર છસો તેર અને છોત્તેર પૈસા પુરા) (ટર્મ લોનની બાકી રકમ રૂા. ૧૪,૬૫,૩૩૫.૯૮ + એમઓઆઈ બાકી રૂા. ૨,૦૧,૧૬૨.૧૮ કુલ રૂા. ૧૬,૬૬,૪૯૮.૧૬ અને ઓસીસી લિમિટની બાકી રકમ રા. ૨૦,હ૧,૧૫૬.૪૯ + એમઓઆઈ બાકી રા. ૨,૩૩,૯૫૯.૧૨

સ્થળ

વારી



SETCO

રજીસ્ટર્ડ ઓફિસઃ બરોડા-ગોધરા હાઇવે, ક્લોલ (પંચમહાલ), પિન કોડ - ૩૮૯ ૩૩૦, ગુજરાત, ભારત ફोनः ०२**६७**६-२७०५०० ● ईन्सः ०२५७५-२३५५२४ ● ઇ-મेલः investor.relations@setcoauto.com ● વेબસાઘટः www.setcoauto.com CIN: L35999GJ1982PLC005203

૩૮મી નોટિસ વાર્ષિક સાધારણ સભા અને ઈ-વોટિંગ માહિતી

આથી સૂચના આપવામાં આવે છે કે સેટકો ઓટોમોટિવ લિમિટેડ ("કંપની") ની ૩૮મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") બુધવાર, ૨૯મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૦૨:૩૦ વાગ્યે (IST) વીડિયો કોન્ફરન્સિંગ ("VC") દ્વારા યોજાશે) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") સામાન્ય પરિપત્ર નં. ૨૦ / ૨૦૨૦, તારીખ ૦૫મી મે, ૨૦૨૦ અનુસાર સામાન્ય પરિપત્ર નં. ૧૪ / ૨૦૨૦ તારીખ ૦૮મી એપ્રિલ, ૨૦૨૦ અને સામાન્ય પરિપત્ર નં. ૧૭ / સાથે વાંચવામાં આવે છે. ૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને સામાન્ય પરિપત્ર ૦૨/ ૨૦૨૧ તારીખ ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("MCA") ("સામૂહિક રીતે MCA પરિપત્ર તરીકે ઓળખવામાં આવે છે") અને SEBI પરિપત્ર તારીખ ૧૨મી મે, ૨૦૨૦ અને ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧, ૦૪થી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજની AGM બોલાવતી નોટિસમાં નિર્ધારિત વ્યવસાયના વ્યવહાર માટે.

એમસીએ અને સેબીના આ પરિપત્રોના પાલનમાં, કંપનીએ મંગળવા૨, ૭મી ડિસેમ્બ૨, ૨૦૨૧ ના ૨ોજ એજીએમ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦–૨૧ની નોટિસ ફક્ત ઇલેક્ટ્રોનિક મોડ લારા જ મોકલવામાં આવી છે, જેમણે તેમના ઈ–મેલ સરનામાં રજીસ્ટર કર્યા છે. કંપની/રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ ("RTA")/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ ("DP"). આ દસ્તાવેજો કંપનીની વેબસાઘટ www.setcoauto.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઘટ એટલે કે BSE લિમિટેડ ("BSE") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિચા લિમિટેડ ("NSE") www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે. અનુક્રમે અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ ("CDSL")ની વેબસાઈટ www.evotingindia.com પર.

કંપની એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૦૮ અનુસાર કંપનીઝ (મેનેબ્મેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાચરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (SEBI) ની જનરલ મીટિંગ અને રેગ્યુલેશન ૪૪ પર સેકેટરિયલ સ્ટાન્ડર્ડ–૨ સાથે વાંચો, ૨૦૧૫"), કારણ કે સમય પર સધારો. કંપની પરી પાંડે છે તેના સભ્યો બધવાર. રરમી ડિસેમ્બર. ર૦૨૧ ના રોજ સરવાળો હોલ્ડિંગ માટે સવિધા બધા ઠરાવો પર મત આપવા માટે તેમના અધિકાર વ્યાયામ, કપાઇ તારીખ હોવા સુયોજિત એજીએમની સૂચના. સભ્યો ઇ–વોટિંગ સિસ્ટમ ("રિમોટ ઇ–વોટિંગ")નો ઉપયોગ કરીને અથવા એજીએમમાં ઈ–વોટિંગ હારા તેમનો મત આપી શકે છે. કંપનીએ એજીએમમાં રિમોટ ઈ–વોટિંગ સુવિધા અને ઈ–વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે CDSL સાથે જોડાણ કર્યું છે. ઈ–વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા/સૂચનો ૩૮મી એજીએમની સૂચનામાં સમાચેલ છે.

આ સંદર્ભે સભાસદોને વધુમાં જણાવવામાં આવે છે કે :

- (a) કંપનીએ મંગળવાર, ૭મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ વાર્ષિક અહેવાલ ૨૦૨૦–૨૧ની સાથે ૩૮મી એજાએમમાં નોટિસ મોકલવાની પ્રક્રિયા પર્ણ કરી છે.
- (b) ઇલેક્ટ્રોનિક માધ્યમથી રિમોટ ઇ–વોટિંગ રવિવાર, ૨૬મી ડિસેમ્બર, ૨૦૨૧ (સવારે ૯:૦૦) થી શરૂ થશે અને મંગળવાર, ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૧ (સાંજે ૫:૦૦ વાગ્યે) સમાપ્ત થશે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી રિમોટ ઇ–વોટિંગને મંગળવાર, ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા પછી મંજૂરી આપવામાં આવશે નહીં.
- (C) ઈ–વોટિંગ હેતુ માટે કટ–ઓફ ડેટ બુધવાર, ૨૨મી ડિસેમ્બર, ૨૦૨૧ ૨હેશે.
- કોઈપણ વ્યક્તિ જે કંપનીના શેર મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ–ઓક તારીખે શેર ધરાવે છે. તે આના પર વિનંતી (d) મોકલીને રિમોટ ઇ–વોટિંગ માટે લોગિન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. helpdesk.evoting@cdslindia.com અથવા ટેલિફોન નંબર પર સંપર્ક કરી શકે છે. ૦૨૨–૨૩૦૫૮૫૪૩. જે વ્યક્તિ કટ–ઓફ તારીખે સભ્ય નથી તેણે એજીએમની સૂચનાને માત્ર માહિતીના હેતુ માટે જ ગણવી જોઈએ.
- VC/OAVM સુવિધા દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યો અને જેમણે રિમોટ ઇ–વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત આપ્યો નથી અને અન્યથા આમ (e) કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા નથી, તેઓ એજીએમ દરમિયાન ઈ–વોટિંગ સિસ્ટમ હારા મત આપવા માટે પાત્ર ૨હેશે. VC/OAVM હારા એજીએમમાં હાજરી આપવા માટેની વિગતવાર સૂચના એજીએમની સૂચનામાં આપવામાં આવી છે.
- જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઇ–વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા એજીએમમાં હાજરી/ભાગ લઈ શક્શે (f) પરંતુ તેમને ફરીથી તેમનો મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- જે વ્યક્તિનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ હારા જાળવવામાં આવેલા લાભદાચી માલિકોના રજિસ્ટરમાં માત્ર કટ–ઓફ તારીખે નોંધાચેલ (g) હોચ તે વ્યક્તિ આ એજીએમ દરમિયાન રિમોટ ઈ–વોટિંગ તેમજ ઈ–વોટિંગની સુવિધાનો લાભ લેવા માટે હકદાર રહેશે.
- જે સભ્યોના ઈમેલ એફેસ કંપની/આરટીએ/ડીપીમાં નોંધાચેલા નથી તેવા સભ્યોના ઈમેલ એડ્રેસની નોંધણીની રીત એજીએમ નોટિસમાં ઉપલબ્ધ છે. (h)
- સ્કુટિનાઈઝર અને સ્પીકર રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયાની વિગતો એજીએમ નોટિસમાં આપવામાં આવી છે. (i)

ઈ–વોટિંગ સિસ્ટમમાંથી એજીએમ અને ઈ–વોટિંગમાં હાજરી આપવા સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓના કિસ્સામાં, તમે મદદ વિભાગ હેઠળ અથવા www.evotingindia.com પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQs") અને ઇ–વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઇ શકો છો. helpdesk.evoting@cdslindia.com પર ઇમેલ લખો અથવા શ્રી નીતિન કુંદર (૦૨૨ – ૨૩૦૫૮૭૩૮) અથવા શ્રી મહેબૂબ લાખાણી (૦૨૨–૨૩૦૫૮૫૪૩) અથવા શ્રી ૨ાકેશ દળવી (૦૨૨–૨૩૦૫૮૫૪૨) નો સંપર્ક કરો.

આગળ કોઈ પ્રશ્નો અથવા ઇ–વોટિંગ પ્રક્રિયા લગતી ફરિયાદના કિસ્સામાં શેરધારકોને સાથે સંપર્કમાં મળી શકે પર ઇમેઇલ લખીને શ્રી હિરેન પી વાળા, કંપની સેક્રેટરી, investor.relations@setcoauto.com અથવા કોઈ ટેલિફોન પર સંપર્ક કરી શકો છો . ૦૨૨–૪૦૭૫૫૫૫૫.

> બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી સેટકો ઓટોમોટિવ લિમિટેડ માટે

ઃ ક્લોલ	હિરેન પી. વાળા
મઃ ૦૭મી ડિસેમ્બર, ૨૦૨૧	કંપનીના સચિવ

રા. ૨૪,૪૧,૯૨૪/- (રા. ચોવીસ લાખ એકતા લોનની બાકી ૨કમ રા. ૨૧,૯૯,૫૭૩ + એમ ૮.૩૦%) તા. ૦૩.૧૨.૨૦૨૧ થી ચૂકવણીની જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસર્ન દેવાદાર ૨કમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં ૨ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી ક સાથે વંચાતી કાચદાની કલમ ૧૩(૪) હેઠળ	સારોઆ દું બાકી રૂા. ૨,૪૨,૩૫૧/- @ તારીખ સુધી તેની પરના વ્યાજ સહીત ! અંદર ચુકવવા જણાવ્યું હતું. માથી દેવાદાર અને જાહેર જનતાને આ રનારે કચિત નિચમોના નિચમ ૮ અને ૯ તેમને/તેણીને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે	પ્લક.૪૯ + એમઓઆઈ બાકી રૂા. ૨,૩૩,૯૫૯.૧૨ વાળો રૂા. ૩૯,૭૧,ક૧૩.७୨) @ ૮.૩૦%) તા. ગલા મહિના સુધીની તારીખ દર્શાવો) તેની પરના મુ અને ખર્ચાના ચાર્જને આધિન રહેશે. ૨ મિલકતનું વર્ણન પંચાલના નામે મોજે વાડજ, તાલુકા અમદાવાદ દ્રેશન ઉપ જીલ્લા અમદાવાદ-૨(વાડજ), ગુજરાત (ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૧૫ ના ફાઈનલ પ્લોટ નં.	સેન્દ્રલ બેંક ઓફ ઇન્ડિયા ક્ષેગ્રીય કાર્યાલય, પરિશિષ્ટ-૪ - એ (નિયમ ૮(૬) ની सेन्ट्रल बैंक ओफ इंडिया લાલ દરવાજા, આવી જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રીતે કરજદારો અને જામીનદારોને નોટીસ આપવામાં આવે છે કે નીચે આપેલ સ્થાવર મિલકતોનું ઇ - હરાજી વેચાણ ધી સિક્યુચીરાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાચ્વાન્લિયલ એસેટ્સ એન્ડ આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રીતે કરજદારો અને જામીનદારોને નોટીસ આપવામાં આવે છે કે નીચે આપેલ સ્થાવર મિલકતોનું ઇ - હરાજી વેચાણ ધી સિક્યુચીરાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાચ્વાન્લિયલ એસેટ્સ એન્ડ પ્રત્યક્ષ કબજો સિકયોર્ડ હેલાદાર, સેન્દ્રલ બેંક ઓફ દન્ડિયાન અને જામીનદારો ને નોટીસ આપવામાં આવે છે કે નીચે આપેલ સ્થાવર મિલકત જે સિકયોર્ડ હેલાદાર પાસે ગિરવે રાખેલ / ચાર્જ કરેલ છે, જેન ધી સિક્યુ ચીરાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાચ્વાન્લિયલ એસેટ્સ એન્ડ પ્રત્યક્ષ કબજો સિકયોર્ડ હેલાદાર, સેન્દ્રલ બેંક ઓફ દન્ડિયાન અને જામીનદારો પસે છે કે ની છે છે કે વીચે આપેલ સ્થાવર મિલકત જે સિકયોર્ડ હેલાદાર પાસે ગિરવે રાખેલ / ચાર્જ કરેલ છે, જેન પ્રત્યક્ષ કબજો સિકયોર્ડ હેલાદાર, સેન્દ્રલ બેંક ઓફ દન્ડિયાન અધિકારીએ લીધો છે તે "જ્યાં છે", "જેમ છે" અને "જે કાઈ છે" તે આધારે કરજદારો અને જામીનદારો પાસે શેન્દ્રલ બેં એફ દન્ડિયાર્ડ બાકી રક્ષનની વસુલાત માટે તા. ૨૮.૧૨.૨૦૨૦ ન રા રેજ વેચાણ કરવામાં આવશે. સંબંધિત મિલકત સામે અનામત કિંમત અને અને મેર્ટ મની ડિપોઝીટની રક્ષ છે.
દશવિલી મિલકતનો તારીખ ૪ ડિસેમ્બર, ૨૦૨૧ ત આથી ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને કરવામાં આવે છે અને મિલકત સાથેનો ક રા. ૨૪,૪૧,૯૨૪/- (રા. ચોવીસ લાખ એકતા લોનની બાકી રક્મ રા. ૨૧,૯૯,૫७૩ + એ ૮.૩૦%) તા. ૦૩.૧૨.૨૦૨૧ મુજબ અને તેના ચાર્જ્સના ચાર્જને આદિાન રહેશે.	મિલક્ત સાથે કોઇ સોદો ન કરવા સાવધ તોઇપણ સોદો ઇન્ડિચન બેંકની સ્કમ બીસ લજાર નવસો ચોવીસ પુરા) (હોમ મઓઆઈ બાકી રૂા. ૨,૪૨,૩૫૧/-@ તારીખ : ૦૪.૧૨.૨૦૨૧	મં. ૨૯૨૬ પૈકી) ધરાવતી જમીન પર બંધાચેલ ઓમ પાર્ટમેન્ટ તરીકે બાણીતી સ્કીમમાં ૬૭.૯૫ ચો.મી. ાુ:સીમા : પૂર્વ : અન્થ મિલક્ત , પશ્ચિમ : પેસેજ , થા. અધિ કૃત અધિકારી ઇન્ડિયન બેંક	કમ તા ઉદારક્તાઓ / જામીનદારો / ગિરવેદારોનું नाम અને શાખાની સંપર્કની વિગત ડિમાન્ડ નોટીસ તારીખ અને બાકી રકમ અને બાકી બાકી રકમ અને બાકી બાકી બાકી રકમ અને બાકી રકમ અને બાકી રકમ અને બાકી રકમ અને બાકી બાકી બાકી બાકી બાકી બાકી બાકી બાકી
સ્થાવર મિલક્ત મિલક્ત : શ્રી રમેશ અંબાલાલ તુરીના ના અમદાવાદ-૩ (મેમનગર)ના ટી.પી.એસ.નં. પૈકી સબ પ્લોટ નં. ૬ ખાતે રહેલ સુધરસ એસ્ સ્કીમમાં આશરે ૧૦૫ ચો.મી. માપના ફ્લે. આકાશ, પશ્ચિમ : ખુલ્લું આકાશ, ઉત્તર : સી.	મે મોજે વસ્ત્રાપુર, જી. અને ઉપ જી. ૧, એફ.પી.નં. ૧૭૧, સર્વે નં. ૧૩૭ કોસિએશનની આંગન તરીકે જાણીતી ટ નં. ૮. ચતુઃસીમા : પૂર્વ : ખુલ્લું		મે. સિદ્ધી ઇન્ડસ્ટ્રીઝ (ઉદ્યારક્ત), શ્રી પ્રકાશકુમાર ચમનાજી સિંઘલ (ભાગીદાર), શ્રી મોહનજી રાધુજી ઠાકોર (ભાગીદાર અને મોર્ગેજર), શ્રી રાજેશભાઈ જેઠાલાલ ઠક્કર (જામીનદાર અને મોર્ગેજર), (ગુલબાઇ ટેક્કરા શાખા, અમદાવાદ) (શ્રી વિનચ સંખધર, અધિકૃત અધિકૃત, અધિકારી, સંપર્ક નં. oecoceecccco) oq.oc.2090 ગુ. ૨ રહેઠાણ લાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હકક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાકોરના નામ અવિભાજીત હક સાથેની રહેઠાણલાયક રો હાઉસ :- મોહનજી રાધુજી ઠાક ના નામ અવિભાજીત હક ગુલ્ય આવ્યું બેલોક નં. ૧૧૦૦/- ગુલ રેકા વાત ક્યુજી હાલ હાવુજી દેહાલ અધિકારી, હત્તરે : ઘર નં. ૨૭, દક્ષિણે : ઘર નં. ૨૫.
ખુલ્લું આકાશ. તારીખ : ૦૪.૧૨.૨૦૨૧ સ્થળ : અમદાવાદ MAS RURAL HOUSING & N FINANCE LIMITED Narayan Chambers, 2th Floor, B/h. Patang Maredabad/30009.Contact : 079-41106	અધિકૃત અધિકારી ઇન્ડિયન બેક	:(૧))(સ્થાવર મિલકત માટે-અમૂલ્ય મિલકત માટે)	3. શ્રીમતી બિનલબેન પૂર્વેશભાઈ 30.99.200 બિનલબેન પૂર્વેશ(ભાઈ ઠક્કરના નામની કાયદેસર ગુરવે મુકેલ કલેટ / યુનિટ નં. ૫૦૭, પાંચમો માળ, જેનું 5. શ્રીમતી બિનલબેન પૂર્વેશ(ક્વાર્ય) 30.99.200 બિનલબેન પૂર્વેશ(બાઈ ઠક્કરના નામની કાયદેસર ગુરવે મુકેલ કલેટ / યુનિટ નં. ૫૦૭, પાંચમો માળ, જેનું અને શ્રી પૂર્વેશ (કેરીટકુમાર ઠક્કર) શ. ગ. ગ. ગ. (સહ-ઉધારકર્તા) ગ. ગ. સં.ગ., ''શ્રીનાથ હાઈટ્સ'' તરીકે ઓળખાતી યોજનાની સમગ્ર બાંયકામ કરેલ જમીન, બીન ખેતીલાયક શ. ૯, ૬૨, ૦૦૦/- (સહ-ઉધારકર્તા) મ. ૨૨૫?, કુલ ક્ષેત્રકળ ૯૧૦ સ્કે. મી., ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૮૦, ફાળવેલ શ. ૯, ૬૨, ૦૦૦/- (એસ. એમ. રોડ શાખા, + ૨૨૫° + અન્ચ ખચાંઝા અન્ચ ખચાંઝ નં. ૨૫/૦, ઙુનું ક્ષેત્ર કળ ૧૫ ૧૮ સ્કે. મી., જે સિથથ મોજે - વટવા, તાલુકો - વટવા, રજસ્ટ્રેશન શ. ૯, ૬૨, ૦૦૦/- અધાક્તારો, સંઘર્ નં. ૪૫/૦, ૪નું ક્ષેત્ર કળ ૧૫ ૧૮ સ્કે. મી., જે સિથ મોજે - વટવા, તાલુકો - વટવા, રજસ્ટ્રેશન શ. ૯, ૬૨, ૦૦/- અધાક્તારો, આધક્તારો, આઇલ્ટા ૨ ૧૧ (અસલાલી), જીલ્લો - અમદાવાદ, રાજય - ગુજરાત. બધી જ પ્રકાર-મુંદ્ર[વેધારો સાલે. ચતુ: સીમા: - પૂર્વે : કલેટ નં. ૫૦૯, પશ્ચિમ : ખુલ્લો એરીયા, ઉત્તરે : લીફટ, શ. ૯૬, ૨૦૦/- અધક્તારો, સંઘર કાર છુદ્ર ૯૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯, ૨૯,
ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફો ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ; નોટિસ આપેલી અને તે નોટીસમાં જણાવેલ્ કરજદાર આ ૨કમ ચૂકવવામાં અસમર્થ ર	ર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ેનો ઓર્ડર ૫૪) : ટ્લ - ૩ મુજબ મળેલ પાવર્સ મુજબ નીચે મુજબના કરજદાર / સહ-કરજદાર / ા રકમ નોટીસ મળ્યાથી દિન ૬૦માં ચુકવવા જણાવેલ. હેલ છે, જેથી સદર કરજદાર / સહ-કરજદાર / જામીનદાર અને જાહેર જન વા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે થતા કોઈ પણ સોદાની ની	અને કાયદા તળેની સેક્શન ૧૩ (૧૨) સાથે 'જામીનદારને નીચે દર્શાવેલ માહીતી મુજબ તાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે	8. શ્रી મનિષક્સાર મહેશભાઇ મકવાણા (ઉદ્યારકતા) ૦૫.૦૩.૨૦૧૮ શ્રી મનિષકુમાર મહેશભાઈ મકવાણા (ઉદ્યારકતા) ૨૫.૦૩.૨૦૧૮ શ્રી મનિષકુમાર મહેશભાઈ મકવાણા ના નામની કાયદેસર ગિરવે મુકેલ મિલકત અને શ્રીમતી મીનાબેન મહેશભાઈ મકવાણા (સહ-ઉધારકતા), (સંતરામ રોડ શાખા, નડીચાદ, શ્રીમતી પ્રિતી સુમન, સિનિચર મેનેજર, સંપર્ક નં. + ૯૧ કરાપ૮૧૫૯૨) ૦૫.૦3.૨૦૧૮ શ્રી મનિષકુમાર મહેશભાઈ મકવાણાના નામની કાયદેસર ગિરવે મુકેલ મિલકત ડી/૪૬, કર્મવીર સુંદરવન, મનજીપુરા, તાલુકો - નડીયાદ, જીલ્લો - ખેડા, ગુજરાત - રા. ૧, ૯, ૧, ૩૩૩/- સંચાર્જ નં. + ૯૧ કરાપ૮૧૫૮૯૨) ૨
પરના વ્યાજ ની રકમ માટે <mark>માસ </mark>	્વા ચતવર્હ્યા આપવામાં આવ છે અને ામલકત સાથ થતા કોઇ પહ્ય સાદાના ન IGસિંગ અને મોર્ગેજ ફાઇ નાન્સ લિ. નાચાર્જમાં ગણાશે.અમો નીચે સહી ક ાથે રૂલ- ૮ તળે મળેલ સત્તાની રૂએ મેળવેલ છે. ાન દોરવામાં આવે છે કે, સદર કાયદાની કલમ ૧ ડની સબ-સેક્શન (૮) મુજ	રનારે નીચે દર્શાવેલી મિલ્કતોનો સાંકેતિક	પ. શ્રી વિજયકુમાર તિજરામ ચોકસે (ઉદારકરત) (સંતરામ રોડ શાખા, નડીચાદ, શ્રીમતી પ્રિતી સુમન, સિનિચર મેનેજર, સંપર્ક નં. + ૯૧ કરૂપ૮૮૧૫૮૯૨) ગ
સાવવતા કરાઉપ કરારા કુછે. કરજદાર/સહ-કરજદાર/ જમીનદારનાં નામ શ્રી દિતેશભાઈ મહેશભાઈ સોલંકી (અરજદાર) ભાવનાબેન દિતેશભાઈ સોલંકી આવેલ રેવન્યુ સર્વે નં. ૩૩૩૫. બ્લોક નં. ૧૮૨ પૈકી ખાતા નં. ૦૩-૧૨-૨૦૨૧	ખ (જે કિમા∞ક નોટિસમાં જણાવ્યા પ્રમાણે) ત્રટ તા.૧૫-૦૫-૨૦૨૧ના રોજ બાકી બ ૩ા.૧૫.૩૪.૮૯૨.૦૦ (અંકે રૂપિયા પંદર લાખ	s. ક્રો સહયોગ પ્લાસ્ટીક , શ્રીમતી રંજનાબેન અશોકભાઈ ઠક્કર (પ્રોપ્રાઈટર, જામીનદાર અને મોર્ગેજર), (ગુલભાઇ ટેકરા શાખા, અમદાવાદ) (શ્રી વિભય સંખધર, આધિકૃત અધિકારી, સંપર્ક નં occoccecc/co) ૦૮.૦૪.૨૦૧૯ ગ્રા. ૧.૫ શ્રીમતી રંજનાબેન અશોકભાઈ ઠક્કર ના નામની કાયદેસર ગિરવે મુકેલ મિલકતનો શેડ નં. ૭, ૮, ૮, સુપર પ્લોટ એરીયાનું સેત્રફળ ૩૮ દ. ૬૯ સ્કે.મી. (વાસ્તવિક પ્લોટ એરીયાનું ૨૦૫.૬૯ સ્કે.મી. + અવિભાજીત હકક સાથેના કોમન રોડ અને કોમન પ્લોટ વગેરેનું ક્ષેત્રફળ ૧૮૧ + ૨ ચાજ + અન્ય ખર્ચાઓ બ્લોક નં. ૧૫૦, સર્વે નં. ૧૫૮, સર્વે બ્લોક નં. ૧૫૦, અર્સે નં. ૧૧૮, સર્વે બ્લોક નં. ૧૫૮, સર્વે બ્લોક નં. ૧૫૮, સર્વે બ્લોક નં. ૧૫૮, સર્વે બ્લોક નં. ૧૫૦, અરેર કરી, ૧૯૦ અને સર્વે	
	૪૩-કે જેનું ક્ષેત્રફળ ૧૧૩૮૨ ચો.મી. પર આવેલ સ્કીમ કે જે ''રામદૂત રેસીડેન્સી'' ના નામથી ઓળખાય છે. તેના પ્લોટ નં. ૧૩૭ (બી-ટાઈપ), (કેજેપી પ્રમાણે બ્લોક નં. ૧૮૨બી/પૈકી-૧૩૭) કે જેનું ૭૧.૮૧ ચો.મી., જમીન અને રોડ રસ્તાના વણવહેંચાયેલા હક્ક, હિસ્સા કે જેનું ક્ષેત્રફળ ૫૦.૨૬ ચો.મી. જેનું કુલ ક્ષેત્રફળ ૧૨૨.૦૭ ચો.મી. તેવી બાંધકામવાળી મિલ્કત.		હ. શ્रી મુરલીધર ટ્રેડીંગ, શ્રી ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિ (પ્રોપ્રાઈટર અને મોર્ગેજર) (ગુલભાઈ ટેકરા શાખા, અમદાવાદ) (શ્રી વિભય સંખર્ધર, આધિકારી, સંપર્ક નં. ૦૯૯૦૯૯૨૮૮૮૦) ૦5.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2096 ગ્ર.05.2097 ગ્ર.
લવલેશ બાબુલાલ કોલ (અરજદાર) લલનીચાદેવી લવલેશ કોલ (સહ અરજદાર)	જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ - ડીસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ મોજે ભરૂંડી, તાલુકો ઓલપાડ ખાતે આવેલ રેવન્યુ સર્વે નં. નં. ૭૬/પૈકી, અને ૯૬/૧ પૈકી અને ૭૫/પૈકી અને ૯૫ પૈકી, બ્લોક નં. ૩૪૩/એ અને ૩૪૩/બી કે જેનુ ક્ષેત્રફળ કુલ ૪૬૮૪૨ ચો.મી. છે,તેના પર આવેલ સ્કીમ કે જે ''શ્રુંગલ હોમ્સ'' ના નામથી ઓળખાય છે. તેના પ્લોટ નં. ૩૧ કે જેનું ક્ષેત્રફળ		શ્રી પાર્થિવ ધીરજલાલ કોટક), શ્રી મોન્ટુકુમાર ધીરજલાલ કોટક (ઠક્કર) - જામીનદાર અને શ્રી ધીરજલાલ નરભેરામ ઠક્કર - જામીનદાર (સોલા રોડ શાખા, અમદાવાદ) (શ્રી સુજન સિંઘ, સિનીચર મેનેજર, સંપર્ક નં. ૦૯૫૬૯૮૮૩૮૩૯) ન વ્યાજ + અન્ય અચીઓ ર). શ્રી મોન્ટકમાર ધીરજલાલ કોટક ના નામની કાયદેસર ગિરવે મકેલ મિલકત કોમર્શિયલ દકાન નં. ૪૪૧. ચોથો માળ. જેનં ક્ષેગ્રકળ ૧૧.૬૧ સ્કે.મી., તેજ ડેવલોપ્સ્સ ગ્રી સ્વીરજલાલ નરભેરામ ઠક્કર - જામીનદાર સાં સ્ટ, સ્ટલ, ૫૯૯/- ગ્રી સ્ટ્રિંગ ર પાર્ઝ માળ, જેનં ક્ષેગ્રકળ ૧૧.૬૧ સ્કે.મી., તેજ ડેવલોપ્સ ગ્રીફેસ નં. ૧૬૫૩/૫/એ, ૧૬૮૦ અને ૧૬૮૧/એ/૧, મોજે શાહપુર - ર, તાલુકો - સીટી, જીલ્લો અને સબ જીલ્લો - અમદાવાદ, ગ્રુજરાત. ચતુઃસીમાં - પૂર્ચ : આફિસ નં. ૩૧૩, ૫શ્વિમે : ઓફિસ નં. ૩૧૪ સાથે કોમન દિવાલ, ઉત્તરે : રોડ, દક્ષિણે : કોમન સીડી.
દિનેશ માંગીલાલ વિશ્વકર્મા	૪૦.૧૮ ચો.મી. વણવહેંચાયેલ હિસ્સો ૨૭.૫૧ ચો.મી., રોડ અને સીઓપી કે જેનું કુલ ક્ષેત્રફળ ૬૭.૬૯ ચો.મી. છે. તેવી બાંધકામ વાળી મિલ્કત. જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ - ડીસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ લોન એકાઉ ૦	e તા.૧૫-૦૫-૨૦૨૧ના રોજ બાકી	અને રાજીવ ડેવલોપ્ર્સ નો રત્નમણી કોમ્પ્લેક્ષ, નગર શેડ નો વાડા ની પાસે, ઘી કાંટા, અમદાવાદ, સીટી સર્વે નં. ૧૬ પ૩/૧/એ, ૧૬૮૦ અને ૧૬૮૧/એ/૧, મોજે શાહપુર - ૨, તાલુકો - સીટી, જીલ્લો અને સબ જીલ્લો - અમદાવાદ, ગુજરાત. ચતુઃસીમા ઃ- પૂર્વે : ઓફિસ નં. ૪૧૩, પશ્ચિમે : ઓફિસ નં. ૪૧૪ સાથે કોમન દિવાલ, ઉત્વરે : રોડ, દક્ષિણે : કોમન સીડી. રોડ, દક્ષિણે : કોમન સીડી.
(અરજદાર)	જેત રજીસ્દ્રશન ડાસ્દ્રાકટ સખ - ડાસ્દ્રાકટ સુરત ખાત આવલ લાન અકાછત મોજે ભરૂંડી, તાલુકો ઓલપાડ ખાતે આવેલ રેવન્યુ સર્વે નં. ૭૯/પી અને ૯૯/૧પી અને ૭૫/પી, બ્લોક નં. ૩૪૩/એ, ૩૪૩/બી કે જેનું ક્ષેત્રફળ ૪૯૮૪૨ ચો.મી. છે. તેના પર આવેલસ્કીમ કે જે "શ્રુંગલ હોમ્સ" ના નામ થી ઓળખાય છે. તેના પ્લોટ નં. ૩૨ કે જેનું ક્ષેત્રફળ ૪૦.૧૮ ચો.મી. વણવહેંચાયેલ હિસ્સો ૨૭.૫૧ ચો.મી રોડ અને સીઓપી કે જેનું કુલ ૬૭.૬૯ ચો.મી. તેવી બાંધકામ વાળી મિલ્કત.	ર ૩ા.૧૦.૩૦.૫૨૩.૦૦ (અંકે રૂપિયા દસ લાખ	નિરીક્ષણની તારીખ અને સમય : ૨૧.૧૨.૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ કલાકે ઇએમડી અને ડોક્ચુમેન્ટ (ઓનલાઈન) જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમય : તા. ૨૯.૧૨.૨૦૨૧ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ઇ - હરાજી ની તારીખ : ૨૮.૧૨.૨૦૨૧, સમય : બપોરે ૨.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી ૧૦ મિનિટના ઓટો - એક્સટેન્સન સાથે હરાજી બેંકના માન્ય સેવા પ્રદાતા https://www.mstcecommerce.com દ્રારા હાથ ધરવામાં આવશે. બિડરોએ https://www.mstcecommerce.com પર રજ્સ્ટર્ડ કરી KYC દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, સર્વિસ પ્રોવઇડર દ્રારા KYC દસ્તાવેજોની ચકાસણી પછી NEFT /RTGS/transfer દ્રારા ગ્લોબલ ઇએમડી વોલેટમાં ઇએમડી જમા કરાવવાની રહેર (https://www.mstcecommerce.com માં ચલણ બનાવ્યા પછી) વધુ વિગતવાર શરતો અને નિયમો માટે www.centralbankofindia.co.in માં આપેલ લીંક અથવા ઓકશ પ્લેટફોર્મ https://www.mstcecommerce.com જોવા વિનંતી છે. હેલ્ય લાઈન નં. ૦૩૩ - ૨૨૯૦૧૦૦૪ અથવા સંબંધિત શાખા અથવા સંબંધિત અધિકૃત અધિકારી અથવા સેત્રિ કાર્ચાલચ, લાલ દરવાજા, અમદાવાદ, શ્રી મનોજકુમાર, ઠાકુર, અધિકૃત અધિકારી, સંપર્ક નં. કરાયcહcહટ૩૬ નો ચાલુ કામકાજના દિવસો દરમિયાન સંપર્ક કરી શકશે.
તારીખ : ૦૮-૧૨-૨૦૨૧ સ્થળ : સુરત	અધિકૃત અધિકારી ક	યી ભરત જે. ભટ્ટ (મો.) ૯હ૧૪૧૯૯૦૧૮ સિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ	સરફેસી એક્ટ - ૨૦૦૨ ના નિચમ ૮(૬) હેઠળ પૈધાનિક ૧૫ દિવસ ની વેચાણ નોટીસ આથી દેવાદારો / જામીનદારો / મોર્ગેજરોને સિકયોર્ડ લેણદારના બાકી લેણાંની વસુલાત માટે સ્થાવર મિલકતના વેચાણની જાણ કરવામાં આવે છે. સહી/ તારીખ : ૦૮.૧૨.૨૦૨૧, સ્થળ : અમદાવાદ (અસલ અંગ્રેજી પરલી અનુવાદ) અધિકૃત અધિકારી, સેન્ટ્રલ ભેંક ઓફ ઇન્ડિસ્